

ત્રણ-વર્ષની-ઉંમરના માટેનું (કિંડરગાર્ટન)

3-YEAR-OLD KINDER

Best Start

Best Life

મોટા સ્વપ્ન જોવા માટે આપણાં
બાળકોને જીવનની ઉત્તમ શરૂઆતની
જરૂર હોય છે



વિક્ટોરિયાની સરકાર એક દાયકા સુધીમાં લગભગ 5 બિલિયન (500 કરોડ) ડોલર, સાર્વત્રિક ભંડોળ પૂરું પાડ્યું હોય તેવા ત્રણ-વર્ષની-ઉંમરના માટેના કિંડરગાર્ટન લાગુ પાડવા રોકાણ કરી રહી છે, અને તે હવે સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ છે.

આનો અર્થ કે, વિક્ટોરિયાના બાળકો માટે ઊંચરવા, રમવા અને મિત્રો બનાવવા માટે વધુ એક વર્ષ.

ત્રણ વર્ષની ઉંમરથી ગુણવત્તાયુક્ત કિંડરગાર્ટન પ્રોગ્રામમાં ભાગ લેવાથી બાળકોના શિક્ષણ, વિકાસ, આરોગ્ય અને સુખાકારીના પરિણામોને વેગ મળે છે.

નાના બાળકો રમત દ્વારા તેમની આસપાસની દુનિયા વિષે શીખે છે.

રમત આધારિત શિક્ષણ નાના બાળકોને શિક્ષણ આપવાની શ્રેષ્ઠ રીત છે. તે બાળકોને તેમની કલ્પના શક્તિનો ઉપયોગ કરવાની, તેમના ભાષા કૌશલ્યો વિકસાવવાની અને સંખ્યા અને સ્વરુપો (પેટર્ન્સ) શિખવાની તક આપે છે. તેઓ બીજા સાથે કેવી રીતે ભળવું, વહેંચીને લેવું, સાંભળીને સમજવું અને તેમની ભાવનાઓની સંભાળ લેતાં પણ શીખે છે.

ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોય તેવા બે વર્ષનાં કિંડરગાર્ટનની વ્યવસ્થા વિક્ટોરિયાના બાળકોને માટે છે.

રાજ્યભરના બાળકોને 2022થી દર અઠવાડિયે ઓછામાં ઓછા પાંચ કલાકનું ભંડોળ પૂરું પડાયેલું હોય તેવા કિંડરગાર્ટનની સુવિધા મળશે. 2029 સુધીમાં આ કલાકો વધીને અઠવાડિયાના 15 કલાક થશે.

તમારું બાળક ગમે ત્યાં કિંડરગાર્ટનમાં જતું હોય, શિક્ષકો અને તાલીમ પામેલા કેળવણીકારો આ કાર્યક્રમનું નેતૃત્વ કરશે.

બાળકો આખા દિવસની બાળસંભાળ સેવા (લોંગ ડે કેર) (ચાઈલ્ડકેર) અથવા ફક્ત કિંડરગાર્ટન હોય ત્યાં કિંડરગાર્ટન કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

નાના બાળકો રમત દ્વારા દુનિયા વિષે શીખે છે

તેઓ બીજા સાથે કેવી રીતે ભળવું, વહેંચીને લેવું, સાંભળીને સમજવું અને તેમની ભાવનાઓની સંભાળ લેતાં શીખે છે.

કિંડરગાર્ટન કાર્યક્રમમાં બાળકો રમતોનો ઉપયોગ તેમના ભાષા કૌશલ્યના વિકાસ માટે અને સંખ્યાઓ અને સ્વરુપો વિષે શીખવામાં કરે છે.

શિક્ષકો અને કેળવણીકારો બાળકોને શીખવા માટે જિજ્ઞાસુ, સર્જનાત્મક અને આત્મવિશ્વાસી બનવામાં મદદ કરે છે.

કિંડરગાર્ટન કાર્યક્રમો વિવિધ રીતે પૂરો પાડી શકાય છે

<p>ફક્ત કિંડરગાર્ટનો</p>	<p>કિંડરગાર્ટન કાર્યક્રમો</p> <p>બાળકો ચોક્કસ દિવસો અને ક્લાકો માટે કિંડરગાર્ટન કાર્યક્રમમાં ભાગ લેશે</p>
<p>આખા દિવસની બાળસંભાળ સેવા</p>	<p>કિંડરગાર્ટન કાર્યક્રમો</p> <p>બાળકો આખા દિવસની બાળસંભાળમાં તેમના સમયના ભાગ રૂપે કિંડરગાર્ટન કાર્યક્રમમાં ભાગ લઈ શકે</p>
	<p>શિક્ષણ અને સંભાળ</p> <p>આખા દિવસની સંભાળ સેવાઓ 0 થી 6 વર્ષની ઉંમરના બાળકોને પ્રારંભિક બાળપણનું શિક્ષણ અને સંભાળ પ્રદાન કરે છે</p>

ભંડોળ પૂરું પાડવામાં આવેલ બધા જ કિંડરગાર્ટન સરકારના સલામતી અને ગુણવત્તા માર્ગદર્શિકાને અનુરૂપ હોવા જોઈએ અને તે વિક્ટોરિયાના પ્રારંભિક વર્ષોના શિક્ષણ અને વિકાસના માળખા પ્રમાણે વિકસાવાયેલ હોવા જોઈએ.

આખા દિવસનું સંભાળ કેન્દ્ર કિંડરગાર્ટન કાર્યક્રમ સહિત આખા દિવસ દરમિયાન શિક્ષણ અને સંભાળ પ્રદાન કરી શકે છે. શિક્ષક દ્વારા ચલાવાતો કિંડરગાર્ટન કાર્યક્રમ શિક્ષણ અને સંભાળના વધારાના ક્લાકો સાથે એકીકૃત કરવામાં આવે છે. ફક્ત કિંડરગાર્ટન જ હોય તેવી સેવાઓમાં, કિંડરગાર્ટન કાર્યક્રમ અમુક દિવસો અને ચોક્કસ સમયે જ ચલાવવામાં આવશે. આ દિવસો અને ક્લાકો કિંડરગાર્ટન સેવા દ્વારા નક્કી કરવામાં આવે છે.

તમારા બાળકને ક્યાં મોકલવું તે તમારા સમુદાયમાં કઈ સેવાઓ ઉપલબ્ધ છે અને તમારા પરિવાર અને બાળક માટે શું વધુ અનુકૂળ આવે છે તેના પર આધાર રાખે છે

સાર્વત્રિક ભંડોળ પૂરું પડાયેલ ત્રણ-વર્ષની-ઉંમરના માટેનાં

કિંડરગાર્ટનમાં બાળકનો દાખલો કરાવવો

તમારા સ્થાનિક કિંડરગાર્ટન સેવા સાથે તેમની દાખલાની પ્રક્રિયા અને સમયરેખા વિષે વાત કરો અને તેમના કેન્દ્ર અને કર્મચારીઓની મુલાકાત લો. તમારું સ્થાનિક કિંડરગાર્ટન શોધવા અને તમારા પરિવાર માટે યોગ્ય સેવા કઈ રીતે શોધવી તેની માહિતી માટે

education.vic.gov.au/choose-kinder ની મુલાકાત લો

ગુણવત્તાવાળું કિંડરગાર્ટન સેવા પસંદ કરવાથી તમારું બાળક કિંડરગાર્ટનમાં તેના સમયનો ઉત્તમ લાભ મેળવશે તે સુનિશ્ચિત કરશે. તમે જે તે સેવાની ગુણવત્તાનું આંકલન www.startingblocks.gov.au ની મુલાકાત લઈને જોઈ શકો છો.

ત્રણ-વર્ષની-ઉંમરના માટેનાં સાર્વત્રિક ભંડોળ પૂરું પડાયેલ

કિંડરગાર્ટન ક્યારે શરૂ કરવું

મોટાભાગની સેવાઓમાં દાખલાની પ્રક્રિયા બાળક કિંડરગાર્ટન કાર્યક્રમ શરૂ કરે તેના એક વર્ષ પહેલાં ખુલે છે, તેથી જ્યારે તમારું બાળક બે વર્ષનું થાય ત્યારે તમારે દાખલા વિષે વિચારવું જોઈએ.

જન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જન્મેલા બાળકોના પરિવારો અને સંભાળકર્તાઓ ત્રણ-વર્ષની-ઉંમરના માટેનાં સાર્વત્રિક ભંડોળ પૂરું પડાયેલ કિંડરગાર્ટન ક્યા વર્ષમાં શરૂ કરવું તે પસંદ કરી શકે છે. પરિવારો તેમના બાળકોને શાળા શરૂ કરવાની ઉંમર સાથે ગોઠવવા માટે આવનાર વર્ષથી ભાગ લેવાનું પસંદ કરી શકે છે, જ્યારે અન્ય બાળકો તેઓ જોડાશે ત્યારે બે વર્ષના હશે.

1 જાન્યુઆરી અને 30 એપ્રિલની વચ્ચે જન્મેલા બાળકો ત્રણ-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન ક્યાં તો તેઓ ત્રણ વર્ષના થાય તે વર્ષે અથવા તેઓ ચાર વર્ષના થાય ત્યારે શરૂ કરી શકે છે.

જો સેવા બે વર્ષના બાળકો માટે શિક્ષક અને બાળકના ગુણોત્તરને પહોંચીવળી શકે તેમ ન હોય બાળકો ત્રણ વર્ષનાં ન થાય ત્યાં સુધી કાર્યક્રમમાં ભાગ ન લઈ શકે તેવું બને.

1 મે અને 31 ડિસેમ્બરની વચ્ચે જન્મેલા બાળકો તેઓ ચાર વર્ષના થાય તે વર્ષમાં જ ત્રણ-વર્ષની-ઉંમરના માટેના કિંડરગાર્ટન અને પાંચ વર્ષના થાય તે વર્ષમાં જ ચાર વર્ષની ઉંમરના માટેના કિંડરગાર્ટનમાં દાખલ થવાને પાત્ર બને છે.

કિંડરગાર્ટન શરૂ કરવાની ઉંમર

બાળકની જન્મ તારીખ	ટિપ્પણીઓ	2020	2021	2022	2023	2024
21 ડિસેમ્બર 2016 – 30 એપ્રિલ 2017	પરિવારો પાસે 2022 અથવા 2023માં શાળા શરૂ કરવાની પસંદગીની ગુંજાઇશ છે	3-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	4-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	પ્રેપ (શાળા માટે તૈયાર થવું)	ધોરણ 1	ધોરણ 2
			3-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	4-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	પ્રેપ (શાળા માટે તૈયાર થવું)	ધોરણ 1
1 મે – 20 ડિસેમ્બર 2017*			3-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	4-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	પ્રેપ (શાળા માટે તૈયાર થવું)	ધોરણ 1
21 ડિસેમ્બર 2017 – 30 એપ્રિલ 2018	પરિવારો પાસે 2023 અથવા 2024માં શાળા શરૂ કરવાની પસંદગીની ગુંજાઇશ છે		3-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	4-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	પ્રેપ (શાળા માટે તૈયાર થવું)	ધોરણ 1
				3-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	4-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	પ્રેપ (શાળા માટે તૈયાર થવું)
1 મે – 20 ડિસેમ્બર 2018*				3-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	4-વર્ષની-ઉંમરના માટેનું કિંડરગાર્ટન	પ્રેપ (શાળા માટે તૈયાર થવું)

*ડિસેમ્બરની તારીખ સરકારી શાળામાં સત્ર 4નો છેલ્લો દિવસ છે. જે તે પરિવારે પસંદ કરેલ શાળામાં જો સત્ર 4નો છેલ્લો દિવસ વહેલા હોય તો, તે તારીખનો ઉપયોગ કરવો.

ત્રણ-વર્ષની-ઉંમરના માટેનાં કિંડરગાર્ટન વિષેના વધુ પ્રશ્નોમાં કોણ મદદ કરી શકે છે

- આખા દિવસની સંભાળ સેવા સહિત તમારી સ્થાનિક કિંડરગાર્ટન સેવા અથવા પ્રદાતા
- તમારી સ્થાનિક કાઉન્સિલ અથવા માતા અને બાળકોના આરોગ્ય માટેની નર્સ
- આરોગ્ય ખાતા (Department of Health – DH)ની પેરેન્ટલાઇનને 13 22 89 પર ફોન કરો
- ઇમેલ 3yo.kindergarten@education.vic.gov.au www.vic.gov.au/kinder મુલાકાત લો.

